

શું તમે તમારી વ્યક્તિગત સુરક્ષા વિશે ચિંતિત છો?

દરેક લોકો મતદાર યાદી પર સાર્વજનિક રૂપે તેમની વિગતો રાખવાનું પર્યાપ્ત સુરક્ષિત અનુભવતા નથી, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ મત આપવાનો તેમનો અધિકાર ગુમાવે છે.

જો તમે નામ નોંધાવવા માટે પાત્ર છો પરંતુ તમારી વિગતોને પ્રિન્ટ કરેલ મતદાર યાદી પર રેકોર્ડ કરેલી રાખવી તે તમારી વ્યક્તિગત સુરક્ષા અથવા તમારા પરિવારના લોકોને જોખમ મૂકી શકે તેવું લાગે, તો તમે ગુપ્ત અપ્રકાશિત યાદી પર જવાની વિનંતી કરી શકો છો.

તમારી નોંધણીની વિગતો ચૂંટણી આયોગ દ્વારા સુરક્ષિત રીતે રાખવામાં આવશે કોઈ અન્ય વ્યક્તિની સામે જાહેર કરવામાં આવશે નહીં.

તમારી વ્યક્તિગત સુરક્ષા વિશે ચિંતા છે?



Complete this form to apply to go on the unpublished roll.

Full name:

Date of birth:

Contact phone number:

Email address

Address where you are enrolled to vote or have applied to enrol:

List any additional information provided to support your application:

Please tick one of the following:

I am already enrolled

I am not enrolled and I have enclosed a completed enrolment form

Signature/date:

➤ Complete and post to: Electoral Commission, PO Box 3220, Wellington 6140.

➤ Remember to attach any information that supports your application to register on the unpublished roll.

➤ For more information visit elections.org.nz

બિનપ્રકાશિત યાદી પર કેવી રીતે જવું.

બિનપ્રકાશિત યાદી પર જવા માટે અરજી કરવા આ બ્રાઉશરમાં આપેલ ફોર્મને ભરો અને તેને પરત કરો. જો તમે વર્તમાનમાં નોંધાયેલા ન હોય, તો તમારે નોંધણી ફોર્મને પણ પૂર્ણ કરવાની જરૂર પડશે. નોંધણીનું ફોર્મ અથવા વધારાની અરજી માટેનું ફોર્મ પ્રાપ્ત કરવા માટે, તમે:

- elections.org.nz પરથી ફોર્મ્સ ડાઉનલોડ કરી શકો છો, અથવા
- **0800 36 76 56** પર કોલ કરી શકો છો અને અમે તમને મેલમાં ફોર્મ્સ પોસ્ટ કરીશું.

મારે કઈ સમર્થન માહિતી પ્રદાન કરવાની જરૂર છે?

તમારે તે બતાવવા માટે સમર્થિત માહિતી પ્રદાન કરવાની જરૂર છે કે તમારે બિનપ્રકાશિત યાદીમાં નોંધવાની જરૂર કેમ છે. સામલે કરવા માટેની માહિતીનાં પ્રકારનાં ઉદાહરણો:

- તમારા નોકરીદાતા, તમારા વકીલ, તમારા સામાજિક કાર્યકર્તા અથવા તમારી કાર્ય અથવા વ્યક્તિગત પરિસ્થિતિઓ તમને જોખમે કેમ મૂકે છે તે સમજાવતા સમુદાયનાં કોઈપણ વ્યક્તિ તરફથી એક પત્ર, અથવા
- સંરક્ષણ આદેશની એક નકલ કે જે ઘરેલું હિંસા અધિનિયમ 1995 હેઠળ લાગુ છે, અથવા
- અવરોધ કરવાના આદેશની એક નકલ કે જે પજવણી અધિનિયમ 1997 હેઠળ લાગુ છે, અથવા
- પોલિસ અધિકારી અથવા સુધાર અધિકારી તરફથી, કેમ તમારું નામ અને સરનામું જાહેર થવાને કારણે તમારી વ્યક્તિગત અથવા તમારા પરિવારની સુરક્ષાને કેમ નુકસાન થઈ શકે તે સમજાવતી માહિતી.



મારી વ્યક્તિગત વિગતોમાં ફેરફાર થાય તો શું કરવું?

જો નોંધણીની તમારી કોઈપણ વિગતો જેમ, તમારું નામ અથવા સરનામું બદલાઈ જાય તો તમારે અમને જણાવવાની જરૂર રહેશે. જો તમારી વ્યક્તિગત પરિસ્થિતિઓ બદલાઈ જાય તો તમે પ્રિન્ટ્સ યાદી પાછા જવા માટે કહી શકો છો

તમારી વિગતો ને અપડેટ કરવા માટે તમારા સ્થાનિક ચૂંટણી રજીસ્ટ્રારનો સંપર્ક કરો. તેઓની સંપર્ક વિગતો elections.org.nz ખાતે ઉપલબ્ધ છે અથવા **0800 36 76 56** પર કોલ કરો.



જ્યારે હું બિનપ્રકાશિત કરેલ યાદી પર હોવ ત્યારે હું કેવી રીતે મત આપી શકું?

તમે સામાન્ય ચૂંટણી અથવા બાય-ચૂંટણીમાં કોઈપણ મત આપવાનાં સ્થાને મત આપી શકો છો. તમારે એક ખાસ મત કાસ્ટ કરવાની જરૂર છે કારણ કે મત આપવાનાં સ્થાને મત આપવા માટે તમારી વિગતો પ્રિન્ટ કરેલ મતદાર યાદીમાં હશે નહીં.

તમે મત આપવા માટે જ્યાં નોંધાયેલા છો તે મતદારની પુષ્ટિ કરવા માટે તમારે તમારા મત આપવાનાં પેપર સાથે એક અતિરિક્ત ફોર્મ ભરવાની જરૂર પડશે. જો તમે ઈચ્છતા ન હોય તો તમારે ફોર્મ પર સરનામું કે પહેલાનાં નામની માહિતીને પૂર્ણ કરવાની જરૂર નથી. તમે જેટલી વધારે માહિતી પ્રદાન કરશો તે મત આપવાની તમારી પાત્રતાની પુષ્ટિ કરવામાં અમને તેટલું જ મદદ કરશે.

તમારે શું કરવું અને ક્યાં જવું તે બતાવવા માટે મતદાન મથક પર એક વ્યક્તિ ઉપલબ્ધ હશે.

સ્થાનિક ચૂંટણીમાં ભાગ લેવા માટે, તમારા સ્થાનિક કાઉન્સિલ ખાતે તમને મતનાં પેપર્સ મોકલવા માટે તમારે મતદાર અધિકારીને કહેવાની જરૂર છે

ELECTIONS

Level 10, 34-42 Manners Street,
PO Box 3220, Wellington 6140.